



PBM POLYTEX LTD.

CIN :L17110GJ1919PLC000495
REGD. OFFICE: OPP. STATION, POST PETLAD – 388450,
DIST: ANAND, GUJARAT,
PHONE: 224001, 224003, STORES: 224005, SALES: 224006,
FAX (02697) 224009, E-Mail: [pbmills@patodiagroup.com](mailto:pbumills@patodiagroup.com)

THROUGH BSE.LISTING CENTRE

Date-31.08.2023

To,
The General Manager
M/s. BSE Limited,
Department of Corporate Services,
Floor 25, P. J. Towers, Dalal Street,
Mumbai – 400001

Company Code: BSE Limited, Listing Code – 514087

Sir / Madam,

SUB: Submission of Copies of Newspaper Notices in respect of the 104th Annual General Meeting ("AGM"), Remote E-Voting Information and Book Closure.

Pursuant to Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015 read with Schedule III thereto, we are enclosing herewith the copies of Newspaper Advertisement of the Notice of 104th AGM, Book Closure and E-Voting information as published in, both English and vernacular language newspapers in "**FINANCIAL EXPRESS**" Newspapers on 30th day of August, 2023.

Kindly take a note of the same.

Thanking you,
Yours faithfully,
For PBM Polytex Limited

Swati Sharda
Company Secretary & Compliance Officer

ENCL: Copies of Newspaper Advertisement.

DCM LIMITED

Regd. Office: Unit Nos. 2050 to 2052, 2nd Floor, Plaza-II, Central Square, 20, Manohar Lal Khurana Marg, Bara Hindu Rao, Delhi-110006
 CIN: L74899DL1899PLC000004 Ph: 011-41539170
 Email id: investors@dcml.in Website: www.dcm.in

NOTICE TO THE MEMBERS OF 133rd ANNUAL GENERAL MEETING (AGM)

Ministry of Corporate Affairs ("MCA") vide its Circular No. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 21/2021, 2/2022, 10/2022 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 14, 2021, May 1, 2022 and December 28, 2022 respectively ("MCA Circulars") and SEBI vide its circulars dated May 12, 2020, January 15, 2021, May 13, 2022 and January 5, 2023 (Collectively referred to as "SEBI Circulars") permitted to hold AGM through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") facility without physical presence of the Members at a common venue. In compliance with the provisions of the Companies Act, 2013 ("Act") and Rules framed thereunder, SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended ("SEBI Listing Regulations"), MCA Circulars and SEBI Circulars, the Board of Directors decided to convene 133rd AGM of the Company on Thursday, September 28, 2023 at 12:30 P.M. through VC / OAVM facility, without physical presence of the Members at a common venue.

Notice of the 133rd AGM and Annual Report will also be made available on Company's website (www.dcm.in), Stock Exchange's website (www.bseindia.com and www.nseindia.com) and on the website of National Securities Depository Limited ("NSDL") (www.evoting.nsdl.com).

Members can join and participate in the 133rd AGM through VC / OAVM facility only. Members participating through VC / OAVM facility shall be counted for the purpose of reckoning quorum under Section 103 to the Act. (Detailed instructions for joining 133rd AGM are provided in Notice of the 133rd AGM).

Company is providing remote e-voting (prior to AGM) and e-voting (during the AGM) facility to all its Members to cast their votes on all the resolutions set out in Notice of the 133rd AGM. (Detailed instructions for remote e-voting and e-voting during the AGM are provided in Notice of the 133rd AGM).

To comply with the provisions of MCA Circulars and SEBI Circulars, Notice of the 133rd AGM and Annual Report for the Financial Year ended March 31, 2023 will be sent by e-mail to those Members, whose e-mail address are already registered with the Company or with their respective Depository Participants ("DP").

As per the process advised by DP, Members holding shares in demat form whose e-mail address are not registered with their DP, are requested to register their e-mail address for receipt of Notice of the 133rd AGM, Annual Report and login details for joining the 133rd AGM through VC/OAVM facility including e-voting with their DP only. The registered e-mail address will also be used for sending future communications.

Further, Members holding shares in physical form who have not registered their e-mail address with the Company or RTA, can register their e-mail address for receipt of Notice of the 133rd AGM, Annual Report and login details for joining 133rd AGM through VC/OAVM facility including e-voting by sending a request to Company at investors@dcml.in or RTA viz. MCS Share Transfer Agent Limited at admin@mcsregistrars.com or contact 011 41408149-52 by providing their name, folio number, scanned copy of the share certificate (front and back) and self-attested scanned copy of PAN and Aadhar Card in support for registering e-mail address.

Members holding shares in physical form are advised to provide mandatory documents (PAN, email address, mobile number, bank account details and nomination) as mandated by SEBI vide Circular No. SEBI/MIRSD/MIRSD_RTAMBP/CIR/2021/655 dated November 3, 2021, Clarification Circular No. SEBIHO/MIRSD/MIRSD_RTAMBP/CIR/2021/687 dated December 14, 2021 and Circular No. SEBIHO/MIRSD/MIRSD-PoD-1/P/CIR/2023/37 dated March 16, 2023 to avoid freeze of their folio on or after October 1, 2023.

Any person, who acquires share(s) and becomes Member of the Company after the date of dispatch of Notice of the 133rd AGM and holding shares as on the cut-off date i.e. Thursday, September 21, 2023, may obtain the Login ID and Password by following the instructions as mentioned in Notice of the 133rd AGM or sending a request at evoting@nsdl.co.in.

In case of any query regarding e-voting, Members may contact Ms. Pallavi Mhatre, Senior Manager, NSDL at 022-4886 7000 and 022-2499 7000 or sent request at evoting@nsdl.co.in or write an e-mail to Compliance Officer of the Company at investors@dcml.in. The above information is being issued for the information and benefit of all the Members of the Company and is in compliance with the MCA and other applicable Circulars.

For DCM Limited
 Sd/-
 Yadvinder Goyal
 Company Secretary

Place: Delhi
 Date: August 29, 2023

PBM POLYTEX LIMITED

CIN : L17110G1919PLC000495
 Regd. Office : Opp. Station Post, Petlad - 388 450, Dist : Anand, Gujarat.
 Phone : (02697) 224001, Fax : (02697) 224009
 Website : www.pbmpolytex.com, Email ID : pbm@patodiagroup.com

Notice of the 104th Annual General Meeting ("AGM"), Remote E-Voting information and Book Closure

Notice is hereby given that:

1. The One Hundred and Fourth (104th) Annual General Meeting (AGM) of the Shareholders of PBM Polytex Limited ("the Company") will be held on **Monday, 25th September, 2023 at 11:00 A.M. (IST)** through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") in compliance with General Circular No. 14/2020 dated April 08, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 05, 2020, 02/2021 dated 13th January, 2021, 21/2021 dated December 14, 2021 and 10/2022 dated December 28, 2022 and other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular Nos. SEBIHO/CFD/CMD2/CIR/2020/79 dated 12th May, 2020, SEBIHO/CFD/CMD2/CIR/2021/11 dated 15th January, 2021 and SEBIHO/CFD/CMD2/CIR/2022/62 dated May 13, 2022 and SEBIHO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "Circulars") vide which, companies are allowed to hold AGMs through VC/OAVM, without the physical presence of members at a common venue. Hence, the 104th AGM of the Company shall be held through VC / OAVM to transact the business as set forth in the Notice of the 104th AGM dated 12th August, 2023. Members participating through the VC / OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

2. In compliance with the Circulars, electronic copies of the Notice of the 104th AGM and Annual Report 2022-23 have been sent to all the members whose email IDs are registered with the Company / Depository Participant(s). These documents are also available on the website of the Company at www.pbmpolytex.com, Stock Exchange websites i.e. BSE Limited (BSE) at www.bseindia.com and also on the NSDL website at www.evoting.nsdl.com an agency appointed for conducting Remote e-voting, e-voting during the process of AGM and VC. The dispatch of Notice of the AGM through emails has been completed on August 29, 2023.

3. Notice is also hereby given that pursuant to the provisions of Section 91 (1) of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from **Sunday, 17th September, 2023 to Monday, 25th September, 2023 (both days are inclusive)** for the purpose of 104th AGM.

4. In terms of Section 108 of the Companies Act, 2013 read with amended Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, the following information is available to the Shareholders of the Company:

Members holding equity shares either in physical form or dematerialized form, as on the cut-off date **Monday, 18th September, 2023**, may cast their vote electronically on the business as set forth in the Notice of the 104th AGM dtd. 12th August, 2023 through the electronic system of NSDL.

All the members are hereby informed that:-

- The business as set forth in the Notice of the 104th AGM dated 12th August, 2023, shall be transacted through remote e-voting and e-voting during the AGM;
- The remote e-voting shall commence on **Friday, 22nd September, 2023 (09.00 Hrs. IST)**;
- The remote e-voting shall close on **Sunday, 24th September, 2023 (17.00 Hrs. IST)**;
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting and / or e-voting system at the AGM shall be **Monday, 18th September, 2023**;
- Any person, who acquires equity shares of the Company and becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding equity shares as on the cut-off date i.e. **Monday, 18th September, 2023**, may obtain / generate the login ID and password as per the instructions given in the Notice of the 104th AGM dtd. 12th August, 2023.
- Members may note that:
 - The remote e-voting module shall be disabled by NSDL beyond 17:00 Hrs. IST on **Sunday, 24th September, 2023** and once the vote on a resolution is cast and confirmed by the member, the member shall not be allowed to change it subsequently;
 - The facility for e-voting will also be made available during the AGM and those members present in the AGM through VC facility, who have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM;
 - The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;
 - A person whose name is recorded in the Register of Members or in the Register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. **Monday, 18th September, 2023** shall only be entitled to avail the facility of remote e-voting and / or e-voting at the AGM and for participation at the AGM.
- The manner of voting remotely, for members holding shares in dematerialized mode / physical mode and for members who have not registered their email addresses, is provided in the Notice of the AGM. The details will also be made available on the website of the Company. Members are requested to visit www.pbmpolytex.com to obtain such details.
- Members holding shares in dematerialized mode, who have not registered / updated their email addresses / Bank Account Details with their Depository Participants, are requested to register / update the same with the Depository Participants with whom they maintain their demat accounts and Members holding shares in physical mode, who have not registered / updated their email addresses / Bank Account Details with the Company, are requested to register / update the same with the Company by sending an e-mail at pbmcs@patodiagroup.com by quoting their Folio Number and attaching a self-attested copy of PAN in order to facilitate the Company to serve the documents through the electronic mode and to receive copies of the Annual Report 2022-23 along with the Notice of the 104th AGM, instructions for remote e-voting & e-voting during AGM and instructions for participation in the AGM through VC.

Alternatively, Members can update their e-mail address, Mobile No., PAN and Bank Account Details on the link given below:

https://www.linkintime.co.in/EmailReg/Email_Register.html

Members who need assistance before or during the AGM, can contact NSDL on 022-48867000 and 022-24997000 or send a request to NSDL office, Ms. Pallavi Mhatre at evoting@nsdl.co.in.

By order of the Board of Directors
 For PBM Polytex Limited
 Sd/-
 Gopal Patodia
 Managing Director
 (DIN : 0014247)

Place: Petlad
 Date: 29.08.2023

GRANDMA TRADING & AGENCIES LIMITED

Regd. Office: Office No. 117, First Floor, Hubtown Solaris, NS Phadke Marg, Andheri (E), Mumbai-400069, Maharashtra, India.
 Email: grandmatrading@gmail.com; Ph: 022-35188514 / 35138615
 CIN: L99999MH1981PLC100740; Website: www.grandmatrading.co.in

NOTICE OF ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE & E-VOTING

NOTICE is hereby given that the 42nd Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Thursday, 21st September, 2023 at 11:00 a.m. at the Registered Office of the Company at Office No. 117, First Floor, Hubtown Solaris, N. S. Phadke Marg, Andheri (E) Mumbai-400069, Maharashtra, India.

The dispatch of Annual report along with Notice of AGM for the year 2023 is completed through electronic mode and members are hereby informed that the Notice of the 42nd AGM, Annual Report and Remote e-voting instructions are also available on company's website www.grandmatrading.com and is also available on the website of BSE Limited, www.bseindia.com.

Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is pleased to provide the facility of casting votes using Electronic Voting System from a place other than the venue of the meeting ("remote e-voting") to its shareholders for transacting the business contained in the Notice.

The remote e-voting period commences on Monday, September 18, 2023 at 9:00 a.m. and ends on Wednesday, September 20, 2023 at 5:00 p.m. No remote e-voting shall be allowed beyond the said date and time. A member, whose name appears in the register of Members / Beneficial owners as on the cut-off date, i.e. Thursday, September 14, 2023, only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the meeting.

Any person who becomes a member of the Company after dispatch of the Notice of the meeting and holding shares as on cut-off date Thursday, September 14, 2023, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the AGM uploaded at our website www.grandmatrading.co.in and website of CDSE - www.evotingindia.com.

The members who are entitled to vote but have not exercised their right to vote through remote e-voting may vote at the AGM through Ballot paper for all business specified in the Notice.

The members who have cast their vote by remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again.

In case of any grievances connected with facility for voting by electronic means, please contact at CDSE email: helpdesk.evoting@cdseindia.com; Tel: 1800 200 5533

Notice is hereby given u/s 91 of the Companies Act, 2013 that the Register of Members and the Share transfer book shall remain closed from Thursday, September 14, 2023 to Thursday, September 21, 2023 (both days inclusive).

By order of the Board of Directors
 Sd/-
 Sonal Nakum
 Company Secretary and Compliance Officer
 Membership No.: AC567693

Place: Mumbai
 Date: 28/08/2023

HOTEL AND RESTAURANT ASSOCIATION (WESTERN INDIA)

CIN: U91101MH1951PL008380
 Regd. Office: 4, Candy House, Mandoli Road, Colaba, Mumbai - 400 001

PUBLIC NOTICE

This is to inform all the Members of the Association that the 73rd Annual General Meeting of the Association will be held on Saturday, 16th September, 2023, at 3:00 pm at TTC Grand Central 287, Dr. Baba Saheb Ambedkar Road, Parel, Mumbai - 400 012, to transact the business in the notice dated 23rd August, 2023, which has as on date been posted at www.hraai.com and sent by email to members whose email IDs are registered with the Association. The Annual Report comprising of the Notice, Executive Committee report and audited Financial Statements has been dispatched to all members through email by the Association on 26th August 2023. If any member of the Association wishes to view the entire notice including the Annual Report can visit the Company's Website i.e. www.hraai.com or may request the same by sending an email to the Association on asg@hraai.com

In compliance with Section 108 of the Companies Act, 2013 and Rule 20(4) of the Companies (Management and Administration) Rules, 2014 the Association is pleased to provide e-voting facility i.e. voting from a place other than the AGM venue to the Association's members through National Securities Depository Limited (NSDL) to enable them to cast their vote electronically for the business to be transacted at the AGM.

All the members of the Association are hereby informed that

- E-voting period will commence on **Tuesday, 12th September, 2023 (9:00 am)** and end on **Friday, 15th September, 2023 (5:00 pm)**.
- The cut-off date for the eligibility for e-voting and voting at the AGM is **Saturday, 09th September, 2023**.
- A person, whose name is recorded in the register of members maintained by the Association as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM through ballot paper.
- Any Association Member not entitled to vote as on the cut-off date on account of non-payment of his / her subscription amount, shall not be entitled to vote by remote e-voting or polling at the AGM venue, despite password and the procedure for remote e-voting being sent to such Association Member. Associate and Affiliate members will not have any voting rights.
- The e-voting module shall be disabled thereafter. Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently or cast vote again.
- The facility for voting by ballot paper/e-voting shall be made available on the day of the AGM and members who have not already cast their vote by remote e-voting shall be able to exercise their rights.
- The Association Members who have cast their vote by remote e-voting may also attend the Meeting but shall not be entitled to cast their vote again on same resolutions at the venue of the meeting.
- The Executive Committee has designated Mr. Martinho Ferrao, as the Scrutinizer, to scrutinize the E-voting and poll at the AGM in a fair and transparent manner.
- The notice containing e-voting procedure is also available on NSDL's website: <https://www.evoting.nsdl.com> and on the Association's website www.hraai.com.
- In case of any query pertaining to E-voting, please visit help and FAQ's section available at the Downloads section: <https://www.evoting.nsdl.com/>. For any other query, the Association Member may contact the office of the HRAAI on (022) 2202 4076 / 2283 1624 / 2281 9773.

BY ORDER OF THE EXECUTIVE COMMITTEE
 Sd/-
 KUNAL GUJRAL
 SECRETARY GENERAL
 HOTEL AND RESTAURANT ASSOCIATION (WESTERN INDIA)

Dated: 28th August, 2023

SALE NOTICE

(In accordance with regulation 33 & Schedule-I of the Insolvency and Bankruptcy Board of India (Liquidation Process) Regulations, 2016)

POLY LOGIC INTERNATIONAL PVT. LTD. - IN LIQUIDATION

Liquidator - Mangesh Vitthal Kekre
 Address: Office No. 607, Chetak Center, RNT Marg,
 Nr. Hotel Shreemaya, Indore, MP - 452001.
 Email: ip.polylogicinternational@gmail.com; Mob: 9752494078

Sale of Assets under Insolvency and Bankruptcy Code, 2016

| Particulars | E-Auction |
|--|---|
| Asset Type | Leasehold rights in MPIDC Land and Building constructed thereon situated at Plot No. 64-B, Industrial Area, Sector-1, Pithampur Dist. Dhar. |
| Date and Time of E-Auction | 28/09/2023, 01:00 pm to 3:00 pm (With unlimited extension of 5 minutes each) |
| Submission of Eligibility Documents by the prospective bidders | From 31st August, 2023 to 13th September, 2023 |
| Last date of submission of EMD | 28/09/2023 till 01:00 pm |

Sale of Assets and Properties owned by Poly Logic International Pvt. Ltd. - In Liquidation forming part of Liquidation Estate formed by the Liquidator, appointed by the Hon'ble National Company Law Tribunal, Mumbai Bench vide order dated 07/12/2022 (order communicated on 11/01/2023). The sale will be done by the undersigned through e-auction service provider i.e. Linkstar Infosys Private Limited www.sauctions.co.in

| (Amount in INR in Lacs) | | | | |
|-------------------------|---|---------------|------------|-------------------|
| Auction Ref. | Particulars of the Asset | Reserve Price | EMD Amount | Incremental Value |
| E-Auction | Leasehold rights in MPIDC Land & Building constructed thereon situated at Plot No. 64-B, Industrial Area, Sector-1, Pithampur Dist. Dhar. | 540.00 | 54.00 | 1.00 |

Important Note:
 E-Auction will be conducted on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATEVER THERE IS BASIS" and "WITHOUT RECOURSE BASIS" through approved service provider i.e. Linkstar Infosys Private Limited www.sauctions.co.in

1. The intending bidder, prior to submitting their bid, should make their independent inquiries regarding the title of property, dues of local taxes, electricity and water charges, maintenance charges, if any and inspect the property at their own expenses and satisfy themselves. The properties mentioned above can be inspected by the prospective bidders at the site with prior appointment by sending email on ip.polylogicinternational@gmail.com

2. The reserve price mentioned above is excluding GST, other taxes, stamp and any other charges applicable on sale.

3. The detailed e-auction process document containing details of the assets, online e-auction Bid Form, Declaration/Undertaking format, general terms and conditions of auction sale are available on website Linkstar Infosys Private Limited www.sauctions.co.in

Mangesh Vitthal Kekre
 Liquidator - Poly Logic International Pvt. Ltd.
 Reg. No.: IBB/PA-001/IP-P00539/2017-18/10964

Date: 30-08-2023
 Place: Indore

ESTRELA BATTERIES LIMITED

Register office: Yusuf Bldg., Veer Nariman Road, Fort, Mumbai 400001.
 CIN: U99999MH1939PLC003031
 Telephone No.: 022-22842790 Email: eb@smaitindia.com

NOTICE REGARDING 84th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING

1. Notice is hereby given that the 84th Annual General Meeting ("AGM") of members of Estrela Batteries Limited will be held on Thursday, 28th September, 2023, at 11:30 A.M. IST through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 and rules made thereunder, General Circular No. 10/2022 dated December 28, 2022 issued by Ministry of Corporate Affairs ("MCA") and various circulars issued earlier by MCA (collectively referred to as "MCA Circulars"), to transact the businesses as set out in the Notice of the 84th AGM.

2. In compliance with above mentioned Circulars, the electronic copies of the Notice of 84th AGM and the Annual Report for the financial year 2022-23 is being sent through electronic mode to those Members whose email addresses are registered with the Company/Depositories. The notice of 84th AGM and Annual Report for the financial year 2022-23 will be made available on the NSDL website www.evoting.nsdl.com.

3. Members can attend and participate in the AGM through VC/OAVM facility only, the details of which will be provided by the Company in the Notice of 84th AGM. Members attending the AGM through VC / OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

4. Manner of registering email addresses for those Members whose email addresses are not registered for obtaining AGM Notice/Annual Report and/or for obtaining login credentials for e-voting on the resolutions set out in this Notice:

- Members holding shares in physical form are requested to consider converting their holdings to dematerialized form. Members can contact the Company or Company's Registrars and Transfer Agents, M/s. Bighshare Services Private Limited ("Bighshare") for assistance in this regard.
- Members who have not yet registered their email addresses are requested to register the same with their DPs in case the shares are held by them in electronic form and with Bighshare in case the shares are held by them in physical form.

5. Manner of casting vote through Remote e-voting (electronically):
 - The facility for voting through electronic voting system is made available at the AGM and the members attending the AGM through VC/OAVM, who have not already cast their vote by remote e-voting, may exercise their right to vote at the AGM through E-Voting. The Company has entered into an arrangement with National Securities Depository Limited for facilitating remote e-voting for AGM.

- Detailed procedure for casting the vote through remote e-voting during e-voting period and during the AGM shall be provided in the Notice of the AGM, which shall also be made available on the website of the NSDL www.evoting.nsdl.com.

- The Members, whose names appear in the Register of Members / list of Beneficial Owners as on Thursday, 21st September, 2023, i.e. the date prior to the commencement of book closure date are entitled to vote on the Resolutions set forth in this Notice. Members who have acquired shares after the dispatch of the Annual Report and before the book closure may approach the Company for issuance of the User ID and Password for exercising their right to vote by electronic means.

6. The Register of Members and Share transfer books of the Company will remain closed Friday, 22nd September, 2023 to Thursday, 28th September, 2023 (both days inclusive) for the purpose of Annual General Meeting of the company.

By order of the Board
 For ESTRELA BATTERIES LIMITED
 Sd/-
 H.R. Jain
 Whole Time Director
 DIN: 00083344

Date: 29.08.2023
 Place: Mumbai

HEALTHY INVESTMENTS LTD

CIN: L65990MH1981PLC025678
 Registered office: 805, 8th Floor, Maker Chambers V, Nariman Point, Mumbai, Maharashtra - 400021
 Email: cshealthyinvestments@gmail.com; website: www.healthyinvestments.co.in

NOTICE OF 41st AGM, E-VOTING AND BOOK CLOSURE

Notice is hereby given that the 41st Annual General Meeting (AGM) of the Company will be held on **Wednesday 20th September, 2023** at Registered Office at 805, 8th Floor, Maker Chambers V, Nariman Point, Mumbai, Maharashtra - 400021 at 11:00 A.M. Notice of the said AGM, e-voting instructions etc. forming part of the Annual Report for the financial year 2022-23 have been sent to the members of the Company electronically whose e-mail IDs are registered with the Depositories and in physical mode to all the other members at their registered addresses. The dispatch / e-mail transmission of the Annual Report has been completed on **26th Day of August, 2023**. The copies of aforesaid documents are available on the website and for inspection at the Registered Office of the Company during office hours.

Notice is also hereby given that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from **14th September, 2023 to 20th September, 2023** (both days inclusive) for the purpose of ensuring 41st Annual general meeting.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is offering e-voting facility to its Members in respect of all the items of business to be transacted at the AGM. The members may transact the said business through voting by electronic means. The Company has engaged National Securities Depository Limited (NSDL) as the authorized agency to provide the e-voting facility.

The remote e-voting facility will commence on **17th September, 2023 at 10:00 AM and ends on 19th September, 2023 at 5:00 PM** (both days inclusive) and shall not be available thereafter. The remote e-voting shall not be allowed after the said date and time and the e-voting module shall be disabled for voting thereafter. During this period, only a person whose name is recorded in the Register of members or in the Register of beneficial owners maintained by the Depositories as on the cut-off date, i.e. **13th day of September, 2023**, shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the AGM. The voting right of the members for e-voting and for physical voting at the meeting shall be in proportionate to their shareholding in the Paid-up Equity Share Capital of the Company as on the said cut-off date.

Any person who acquires shares of the Company and becomes its member after the dispatch of Notice and holding shares as on cut-off

optemus
OPTIEMUS INFRACOM LIMITED
 CIN: L64200DL1993PLC054086
 Registered Office: K-20, Second Floor, Lajpat Nagar - I, New Delhi - 110024
 Corporate Office: D-348, Sector-63, Noida, Uttar Pradesh - 201307
 Website: www.optemus.com | Email: info@optemus.com | Ph: 011-29840906

NOTICE
 Notice is hereby given that the 30th Annual General Meeting ("AGM") of the Company will be held on Friday, the 27th Day of September, 2023 at 11:00 A.M. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") in compliance with the provisions of Companies Act, 2013 read with rules made thereunder and the Securities and Exchange Board of India ("SEBI") read with General Circular Nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 19/2021, 21/2021 and 02/2022 dated April 08, 2020, April 13, 2020, May 05, 2020, January 13, 2021, December 08, 2021, December 14, 2021 and May 05, 2022, respectively, followed by Circular Nos. 10/2022 and 11/2022 dated December 28, 2022 issued by Ministry of Corporate Affairs ("MCA") and Circular No. SEBI/HO/CFD/PO-2/ CIR/P/2023/4 dated January 05, 2023 issued by SEBI and all other applicable notifications and circulars issued by the MCA and SEBI, to transact the business as set out in the Notice of AGM. Company's Registered Office situated at K-20, 2nd Floor, Lajpat Nagar-I, New Delhi-110024 will be considered as venue for the purpose of this AGM.

In compliance with the above circulars, electronic copies of the Notice of AGM along with the Annual Report for the Financial Year 2022-23 have been e-mailed to all the shareholders whose e-mail address are registered/available with the Company/RTA/Depository Participants. The e-mailing of Notice of AGM have been completed on 29th August, 2023 in conformity with regulatory requirements. In terms of Section 108 of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing facility for remote e-Voting through Central Depository Services (India) Limited ("CDSL") through its website www.evotingindia.com to enable the members to cast their vote electronically. The facility for e-Voting shall also be made available during the AGM for those members who have not already cast their vote by remote e-Voting. Shareholders, whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories/RTA as on the cut-off date of 19th September, 2023 shall be entitled to avail the facility of remote e-Voting or e-Voting during the AGM.

The remote e-Voting period will commence from Tuesday, 19th September, 2023 at 9:00 A.M. (IST) and will end on Thursday, 21st September, 2023 at 5:00 P.M. (IST), after which remote e-Voting will be blocked by CDSL. No remote e-Voting shall be allowed beyond the said date and time. Members, who cast their votes by remote e-Voting, may attend the AGM but will not be entitled to cast their votes again.

Shareholders who have acquired shares and become member of the Company after the dispatch of notice may obtain the login ID and password by sending an e-mail to Central Depository Services (India) Limited (CDSL) at helpline@evotingindia.com or by contacting at 022-23083733, 022-23085834/342. The said e-mail and numbers can also be contacted to address the queries connected with facility for e-Voting and attending the AGM through V.C / OAVM.

Pursuant to Section 91 of the Companies Act, 2013, Rule 10 of the Companies (Management & Administration) Rules, 2014 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of the Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, 16th September, 2023 to Friday, 22nd September, 2023 (both days inclusive) for the purpose of taking record of the shareholders at the AGM.

The Notice of AGM along with the detailed instructions for e-Voting and joining the AGM through VC / OAVM and Annual Report for the Financial Year 2022-23 is also available on the website of the Company at www.optemus.com and on the websites of the Stock Exchanges i.e. www.bseindia.com and www.nseindia.com and on CDSL's website at www.evotingindia.com.

By order of the Board
For Optemus Infracom Limited
 Sd/-
 Vikas Chandra
 Company Secretary & Compliance Officer

Date: August 29, 2023
 Place: Noida (U.P.)

આનંદ રેવોન્સ લીમીટેડ
 CIN: L51909GJ2018PLC104200
 ૩૦૫-૩૦૬, ૧૪૪ સાગર કોમ્પ્લેક્સ, સન જેલ સાય, ખટોદરા, સુરત-૩૯૫૦૦૨.
 ફોન : ૦૨૬૧-૨૬૩૫૫૨૧/૨૨ | ઈમેલ : anandrayonsnl@gmail.com
 વેબસાઇટ : www.anandrayons.com

પાંચમી વાર્ષિક સામાન્ય સભા ("એજુએમ") ઇ-મતદાન અને ચોપડા બંધ તારીખની નોટીસ

આથી સૂચના આપવામાં આવે છે કે આનંદ રેવોન્સ લિમિટેડના સભ્યોની પાંચમી વાર્ષિક સામાન્ય સભા (એજુએમ) ગુરુવાર, તા. ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ બપોરે ૦૩.૦૦ (આઈએસટી) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાવાની છે. સામાન્ય પરિપત્ર નંબર ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૨૨/૨૦૨૦, ૨૩/૨૦૨૦, ૨૪/૨૦૨૦, ૨૫/૨૦૨૦, ૨૬/૨૦૨૦, ૨૭/૨૦૨૦, ૨૮/૨૦૨૦, ૨૯/૨૦૨૦, ૩૦/૨૦૨૦, ૩૧/૨૦૨૦, ૧/૨૦૨૧, ૨/૨૦૨૧, ૩/૨૦૨૧, ૪/૨૦૨૧, ૫/૨૦૨૧, ૬/૨૦૨૧, ૭/૨૦૨૧, ૮/૨૦૨૧, ૯/૨૦૨૧, ૧૦/૨૦૨૧, ૧૧/૨૦૨૧, ૧૨/૨૦૨૧, ૧૩/૨૦૨૧, ૧૪/૨૦૨૧, ૧૫/૨૦૨૧, ૧૬/૨૦૨૧, ૧૭/૨૦૨૧, ૧૮/૨૦૨૧, ૧૯/૨૦૨૧, ૨૦/૨૦૨૧, ૨૧/૨૦૨૧, ૨૨/૨૦૨૧, ૨૩/૨૦૨૧, ૨૪/૨૦૨૧, ૨૫/૨૦૨૧, ૨૬/૨૦૨૧, ૨૭/૨૦૨૧, ૨૮/૨૦૨૧, ૨૯/૨૦૨૧, ૩૦/૨૦૨૧, ૩૧/૨૦૨૧, ૧/૨૦૨૨, ૨/૨૦૨૨, ૩/૨૦૨૨, ૪/૨૦૨૨, ૫/૨૦૨૨, ૬/૨૦૨૨, ૭/૨૦૨૨, ૮/૨૦૨૨, ૯/૨૦૨૨, ૧૦/૨૦૨૨, ૧૧/૨૦૨૨, ૧૨/૨૦૨૨, ૧૩/૨૦૨૨, ૧૪/૨૦૨૨, ૧૫/૨૦૨૨, ૧૬/૨૦૨૨, ૧૭/૨૦૨૨, ૧૮/૨૦૨૨, ૧૯/૨૦૨૨, ૨૦/૨૦૨૨, ૨૧/૨૦૨૨, ૨૨/૨૦૨૨, ૨૩/૨૦૨૨, ૨૪/૨૦૨૨, ૨૫/૨૦૨૨, ૨૬/૨૦૨૨, ૨૭/૨૦૨૨, ૨૮/૨૦૨૨, ૨૯/૨૦૨૨, ૩૦/૨૦૨૨, ૩૧/૨૦૨૨, ૧/૨૦૨૩, ૨/૨૦૨૩, ૩/૨૦૨૩, ૪/૨૦૨૩, ૫/૨૦૨૩, ૬/૨૦૨૩, ૭/૨૦૨૩, ૮/૨૦૨૩, ૯/૨૦૨૩, ૧૦/૨૦૨૩, ૧૧/૨૦૨૩, ૧૨/૨૦૨૩, ૧૩/૨૦૨૩, ૧૪/૨૦૨૩, ૧૫/૨૦૨૩, ૧૬/૨૦૨૩, ૧૭/૨૦૨૩, ૧૮/૨૦૨૩, ૧૯/૨૦૨૩, ૨૦/૨૦૨૩, ૨૧/૨૦૨૩, ૨૨/૨૦૨૩, ૨૩/૨૦૨૩, ૨૪/૨૦૨૩, ૨૫/૨૦૨૩, ૨૬/૨૦૨૩, ૨૭/૨૦૨૩, ૨૮/૨૦૨૩, ૨૯/૨૦૨૩, ૩૦/૨૦૨૩, ૩૧/૨૦૨૩, ૧/૨૦૨૪, ૨/૨૦૨૪, ૩/૨૦૨૪, ૪/૨૦૨૪, ૫/૨૦૨૪, ૬/૨૦૨૪, ૭/૨૦૨૪, ૮/૨૦૨૪, ૯/૨૦૨૪, ૧૦/૨૦૨૪, ૧૧/૨૦૨૪, ૧૨/૨૦૨૪, ૧૩/૨૦૨૪, ૧૪/૨૦૨૪, ૧૫/૨૦૨૪, ૧૬/૨૦૨૪, ૧૭/૨૦૨૪, ૧૮/૨૦૨૪, ૧૯/૨૦૨૪, ૨૦/૨૦૨૪, ૨૧/૨૦૨૪, ૨૨/૨૦૨૪, ૨૩/૨૦૨૪, ૨૪/૨૦૨૪, ૨૫/૨૦૨૪, ૨૬/૨૦૨૪, ૨૭/૨૦૨૪, ૨૮/૨૦૨૪, ૨૯/૨૦૨૪, ૩૦/૨૦૨૪, ૩૧/૨૦૨૪, ૧/૨૦૨૫, ૨/૨૦૨૫, ૩/૨૦૨૫, ૪/૨૦૨૫, ૫/૨૦૨૫, ૬/૨૦૨૫, ૭/૨૦૨૫, ૮/૨૦૨૫, ૯/૨૦૨૫, ૧૦/૨૦૨૫, ૧૧/૨૦૨૫, ૧૨/૨૦૨૫, ૧૩/૨૦૨૫, ૧૪/૨૦૨૫, ૧૫/૨૦૨૫, ૧૬/૨૦૨૫, ૧૭/૨૦૨૫, ૧૮/૨૦૨૫, ૧૯/૨૦૨૫, ૨૦/૨૦૨૫, ૨૧/૨૦૨૫, ૨૨/૨૦૨૫, ૨૩/૨૦૨૫, ૨૪/૨૦૨૫, ૨૫/૨૦૨૫, ૨૬/૨૦૨૫, ૨૭/૨૦૨૫, ૨૮/૨૦૨૫, ૨૯/૨૦૨૫, ૩૦/૨૦૨૫, ૩૧/૨૦૨૫, ૧/૨૦૨૬, ૨/૨૦૨૬, ૩/૨૦૨૬, ૪/૨૦૨૬, ૫/૨૦૨૬, ૬/૨૦૨૬, ૭/૨૦૨૬, ૮/૨૦૨૬, ૯/૨૦૨૬, ૧૦/૨૦૨૬, ૧૧/૨૦૨૬, ૧૨/૨૦૨૬, ૧૩/૨૦૨૬, ૧૪/૨૦૨૬, ૧૫/૨૦૨૬, ૧૬/૨૦૨૬, ૧૭/૨૦૨૬, ૧૮/૨૦૨૬, ૧૯/૨૦૨૬, ૨૦/૨૦૨૬, ૨૧/૨૦૨૬, ૨૨/૨૦૨૬, ૨૩/૨૦૨૬, ૨૪/૨૦૨૬, ૨૫/૨૦૨૬, ૨૬/૨૦૨૬, ૨૭/૨૦૨૬, ૨૮/૨૦૨૬, ૨૯/૨૦૨૬, ૩૦/૨૦૨૬, ૩૧/૨૦૨૬, ૧/૨૦૨૭, ૨/૨૦૨૭, ૩/૨૦૨૭, ૪/૨૦૨૭, ૫/૨૦૨૭, ૬/૨૦૨૭, ૭/૨૦૨૭, ૮/૨૦૨૭, ૯/૨૦૨૭, ૧૦/૨૦૨૭, ૧૧/૨૦૨૭, ૧૨/૨૦૨૭, ૧૩/૨૦૨૭, ૧૪/૨૦૨૭, ૧૫/૨૦૨૭, ૧૬/૨૦૨૭, ૧૭/૨૦૨૭, ૧૮/૨૦૨૭, ૧૯/૨૦૨૭, ૨૦/૨૦૨૭, ૨૧/૨૦૨૭, ૨૨/૨૦૨૭, ૨૩/૨૦૨૭, ૨૪/૨૦૨૭, ૨૫/૨૦૨૭, ૨૬/૨૦૨૭, ૨૭/૨૦૨૭, ૨૮/૨૦૨૭, ૨૯/૨૦૨૭, ૩૦/૨૦૨૭, ૩૧/૨૦૨૭, ૧/૨૦૨૮, ૨/૨૦૨૮, ૩/૨૦૨૮, ૪/૨૦૨૮, ૫/૨૦૨૮, ૬/૨૦૨૮, ૭/૨૦૨૮, ૮/૨૦૨૮, ૯/૨૦૨૮, ૧૦/૨૦૨૮, ૧૧/૨૦૨૮, ૧૨/૨૦૨૮, ૧૩/૨૦૨૮, ૧૪/૨૦૨૮, ૧૫/૨૦૨૮, ૧૬/૨૦૨૮, ૧૭/૨૦૨૮, ૧૮/૨૦૨૮, ૧૯/૨૦૨૮, ૨૦/૨૦૨૮, ૨૧/૨૦૨૮, ૨૨/૨૦૨૮, ૨૩/૨૦૨૮, ૨૪/૨૦૨૮, ૨૫/૨૦૨૮, ૨૬/૨૦૨૮, ૨૭/૨૦૨૮, ૨૮/૨૦૨૮, ૨૯/૨૦૨૮, ૩૦/૨૦૨૮, ૩૧/૨૦૨૮, ૧/૨૦૨૯, ૨/૨૦૨૯, ૩/૨૦૨૯, ૪/૨૦૨૯, ૫/૨૦૨૯, ૬/૨૦૨૯, ૭/૨૦૨૯, ૮/૨૦૨૯, ૯/૨૦૨૯, ૧૦/૨૦૨૯, ૧૧/૨૦૨૯, ૧૨/૨૦૨૯, ૧૩/૨૦૨૯, ૧૪/૨૦૨૯, ૧૫/૨૦૨૯, ૧૬/૨૦૨૯, ૧૭/૨૦૨૯, ૧૮/૨૦૨૯, ૧૯/૨૦૨૯, ૨૦/૨૦૨૯, ૨૧/૨૦૨૯, ૨૨/૨૦૨૯, ૨૩/૨૦૨૯, ૨૪/૨૦૨૯, ૨૫/૨૦૨૯, ૨૬/૨૦૨૯, ૨૭/૨૦૨૯, ૨૮/૨૦૨૯, ૨૯/૨૦૨૯, ૩૦/૨૦૨૯, ૩૧/૨૦૨૯, ૧/૨૦૩૦, ૨/૨૦૩૦, ૩/૨૦૩૦, ૪/૨૦૩૦, ૫/૨૦૩૦, ૬/૨૦૩૦, ૭/૨૦૩૦, ૮/૨૦૩૦, ૯/૨૦૩૦, ૧૦/૨૦૩૦, ૧૧/૨૦૩૦, ૧૨/૨૦૩૦, ૧૩/૨૦૩૦, ૧૪/૨૦૩૦, ૧૫/૨૦૩૦, ૧૬/૨૦૩૦, ૧૭/૨૦૩૦, ૧૮/૨૦૩૦, ૧૯/૨૦૩૦, ૨૦/૨૦૩૦, ૨૧/૨૦૩૦, ૨૨/૨૦૩૦, ૨૩/૨૦૩૦, ૨૪/૨૦૩૦, ૨૫/૨૦૩૦, ૨૬/૨૦૩૦, ૨૭/૨૦૩૦, ૨૮/૨૦૩૦, ૨૯/૨૦૩૦, ૩૦/૨૦૩૦, ૩૧/૨૦૩૦, ૧/૨૦૩૧, ૨/૨૦૩૧, ૩/૨૦૩૧, ૪/૨૦૩૧, ૫/૨૦૩૧, ૬/૨૦૩૧, ૭/૨૦૩૧, ૮/૨૦૩૧, ૯/૨૦૩૧, ૧૦/૨૦૩૧, ૧૧/૨૦૩૧, ૧૨/૨૦૩૧, ૧૩/૨૦૩૧, ૧૪/૨૦૩૧, ૧૫/૨૦૩૧, ૧૬/૨૦૩૧, ૧૭/૨૦૩૧, ૧૮/૨૦૩૧, ૧૯/૨૦૩૧, ૨૦/૨૦૩૧, ૨૧/૨૦૩૧, ૨૨/૨૦૩૧, ૨૩/૨૦૩૧, ૨૪/૨૦૩૧, ૨૫/૨૦૩૧, ૨૬/૨૦૩૧, ૨૭/૨૦૩૧, ૨૮/૨૦૩૧, ૨૯/૨૦૩૧, ૩૦/૨૦૩૧, ૩૧/૨૦૩૧, ૧/૨૦૩૨, ૨/૨૦૩૨, ૩/૨૦૩૨, ૪/૨૦૩૨, ૫/૨૦૩૨, ૬/૨૦૩૨, ૭/૨૦૩૨, ૮/૨૦૩૨, ૯/૨૦૩૨, ૧૦/૨૦૩૨, ૧૧/૨૦૩૨, ૧૨/૨૦૩૨, ૧૩/૨૦૩૨, ૧૪/૨૦૩૨, ૧૫/૨૦૩૨, ૧૬/૨૦૩૨, ૧૭/૨૦૩૨, ૧૮/૨૦૩૨, ૧૯/૨૦૩૨, ૨૦/૨૦૩૨, ૨૧/૨૦૩૨, ૨૨/૨૦૩૨, ૨૩/૨૦૩૨, ૨૪/૨૦૩૨, ૨૫/૨૦૩૨, ૨૬/૨૦૩૨, ૨૭/૨૦૩૨, ૨૮/૨૦૩૨, ૨૯/૨૦૩૨, ૩૦/૨૦૩૨, ૩૧/૨૦૩૨, ૧/૨૦૩૩, ૨/૨૦૩૩, ૩/૨૦૩૩, ૪/૨૦૩૩, ૫/૨૦૩૩, ૬/૨૦૩૩, ૭/૨૦૩૩, ૮/૨૦૩૩, ૯/૨૦૩૩, ૧૦/૨૦૩૩, ૧૧/૨૦૩૩, ૧૨/૨૦૩૩, ૧૩/૨૦૩૩, ૧૪/૨૦૩૩, ૧૫/૨૦૩૩, ૧૬/૨૦૩૩, ૧૭/૨૦૩૩, ૧૮/૨૦૩૩, ૧૯/૨૦૩૩, ૨૦/૨૦૩૩, ૨૧/૨૦૩૩, ૨૨/૨૦૩૩, ૨૩/૨૦૩૩, ૨૪/૨૦૩૩, ૨૫/૨૦૩૩, ૨૬/૨૦૩૩, ૨૭/૨૦૩૩, ૨૮/૨૦૩૩, ૨૯/૨૦૩૩, ૩૦/૨૦૩૩, ૩૧/૨૦૩૩, ૧/૨૦૩૪, ૨/૨૦૩૪, ૩/૨૦૩૪, ૪/૨૦૩૪, ૫/૨૦૩૪, ૬/૨૦૩૪, ૭/૨૦૩૪, ૮/૨૦૩૪, ૯/૨૦૩૪, ૧૦/૨૦૩૪, ૧૧/૨૦૩૪, ૧૨/૨૦૩૪, ૧૩/૨૦૩૪, ૧૪/૨૦૩૪, ૧૫/૨૦૩૪, ૧૬/૨૦૩૪, ૧૭/૨૦૩૪, ૧૮/૨૦૩૪, ૧૯/૨૦૩૪, ૨૦/૨૦૩૪, ૨૧/૨૦૩૪, ૨૨/૨૦૩૪, ૨૩/૨૦૩૪, ૨૪/૨૦૩૪, ૨૫/૨૦૩૪, ૨૬/૨૦૩૪, ૨૭/૨૦૩૪, ૨૮/૨૦૩૪, ૨૯/૨૦૩૪, ૩૦/૨૦૩૪, ૩૧/૨૦૩૪, ૧/૨૦૩૫, ૨/૨૦૩૫, ૩/૨૦૩૫, ૪/૨૦૩૫, ૫/૨૦૩૫, ૬/૨૦૩૫, ૭/૨૦૩૫, ૮/૨૦૩૫, ૯/૨૦૩૫, ૧૦/૨૦૩૫, ૧૧/૨૦૩૫, ૧૨/૨૦૩૫, ૧૩/૨૦૩૫, ૧૪/૨૦૩૫, ૧૫/૨૦૩૫, ૧૬/૨૦૩૫, ૧૭/૨૦૩૫, ૧૮/૨૦૩૫, ૧૯/૨૦૩૫, ૨૦/૨૦૩૫, ૨૧/૨૦૩૫, ૨૨/૨૦૩૫, ૨૩/૨૦૩૫, ૨૪/૨૦૩૫, ૨૫/૨૦૩૫, ૨૬/૨૦૩૫, ૨૭/૨૦૩૫, ૨૮/૨૦૩૫, ૨૯/૨૦૩૫, ૩૦/૨૦૩૫, ૩૧/૨૦૩૫, ૧/૨૦૩૬, ૨/૨૦૩૬, ૩/૨૦૩૬, ૪/૨૦૩૬, ૫/૨૦૩૬, ૬/૨૦૩૬, ૭/૨૦૩૬, ૮/૨૦૩૬, ૯/૨૦૩૬, ૧૦/૨૦૩૬, ૧૧/૨૦૩૬, ૧૨/૨૦૩૬, ૧૩/૨૦૩૬, ૧૪/૨૦૩૬, ૧૫/૨૦૩૬, ૧૬/૨૦૩૬, ૧૭/૨૦૩૬, ૧૮/૨૦૩૬, ૧૯/૨૦૩૬, ૨૦/૨૦૩૬, ૨૧/૨૦૩૬, ૨૨/૨૦૩૬, ૨૩/૨૦૩૬, ૨૪/૨૦૩૬, ૨૫/૨૦૩૬, ૨૬/૨૦૩૬, ૨૭/૨૦૩૬, ૨૮/૨૦૩૬, ૨૯/૨૦૩૬, ૩૦/૨૦૩૬, ૩૧/૨૦૩૬, ૧/૨૦૩૭, ૨/૨૦૩૭, ૩/૨૦૩૭, ૪/૨૦૩૭, ૫/૨૦૩૭, ૬/૨૦૩૭, ૭/૨૦૩૭, ૮/૨૦૩૭, ૯/૨૦૩૭, ૧૦/૨૦૩૭, ૧૧/૨૦૩૭, ૧૨/૨૦૩૭, ૧૩/૨૦૩૭, ૧૪/૨૦૩૭, ૧૫/૨૦૩૭, ૧૬/૨૦૩૭, ૧૭/૨૦૩૭, ૧૮/૨૦૩૭, ૧૯/૨૦૩૭, ૨૦/૨૦૩૭, ૨૧/૨૦૩૭, ૨૨/૨૦૩૭, ૨૩/૨૦૩૭, ૨૪/૨૦૩૭, ૨૫/૨૦૩૭, ૨૬/૨૦૩૭, ૨૭/૨૦૩૭, ૨૮/૨૦૩૭, ૨૯/૨૦૩૭, ૩૦/૨૦૩૭, ૩૧/૨૦૩૭, ૧/૨૦૩૮, ૨/૨૦૩૮, ૩/૨૦૩૮, ૪/૨૦૩૮, ૫/૨૦૩૮, ૬/૨૦૩૮, ૭/૨૦૩૮, ૮/૨૦૩૮, ૯/૨૦૩૮, ૧૦/૨૦૩૮, ૧૧/૨૦૩૮, ૧૨/૨૦૩૮, ૧૩/૨૦૩૮, ૧૪/૨૦૩૮, ૧૫/૨૦૩૮, ૧૬/૨૦૩૮, ૧૭/૨૦૩૮, ૧૮/૨૦૩૮, ૧૯/૨૦૩૮, ૨૦/૨૦૩૮, ૨૧/૨૦૩૮, ૨૨/૨૦૩૮, ૨૩/૨૦૩૮, ૨૪/૨૦૩૮, ૨૫/૨૦૩૮, ૨૬/૨૦૩૮, ૨૭/૨૦૩૮, ૨૮/૨૦૩૮, ૨૯/૨૦૩૮, ૩૦/૨૦૩૮, ૩૧/૨૦૩૮, ૧/૨૦૩૯, ૨/૨૦૩૯, ૩/૨૦૩૯, ૪/૨૦૩૯, ૫/૨૦૩૯, ૬/૨૦૩૯, ૭/૨૦૩૯, ૮/૨૦૩૯, ૯/૨૦૩૯, ૧૦/૨૦૩૯, ૧૧/૨૦૩૯, ૧૨/૨૦૩૯, ૧૩/૨૦૩૯, ૧૪/૨૦૩૯, ૧૫/૨૦૩૯, ૧૬/૨૦૩૯, ૧૭/૨૦૩૯, ૧૮/૨૦૩૯, ૧૯/૨૦૩૯, ૨૦/૨૦૩૯, ૨૧/૨૦૩૯, ૨૨/૨૦૩૯, ૨૩/૨૦૩૯, ૨૪/૨૦૩૯, ૨૫/૨૦૩૯, ૨૬/૨૦૩૯, ૨૭/૨૦૩૯, ૨૮/૨૦૩૯, ૨૯/૨૦૩૯, ૩૦/૨૦૩૯, ૩૧/૨૦૩૯, ૧/૨૦૪૦, ૨/૨૦૪૦, ૩/૨૦૪૦, ૪/૨૦૪૦, ૫/૨૦૪૦, ૬/૨૦૪૦, ૭/૨૦૪૦, ૮/૨૦૪૦, ૯/૨૦૪૦, ૧૦/૨૦૪૦, ૧૧/૨૦૪૦, ૧૨/૨૦૪૦, ૧૩/૨૦૪૦, ૧૪/૨૦૪૦, ૧૫/૨૦૪૦, ૧૬/૨૦૪૦, ૧૭/૨૦૪૦, ૧૮/૨૦૪૦, ૧૯/૨૦૪૦, ૨૦/૨૦૪૦, ૨૧/૨૦૪૦, ૨૨/૨૦૪૦, ૨૩/૨૦૪૦, ૨૪/૨૦૪૦, ૨૫/૨૦૪૦, ૨૬/૨૦૪૦, ૨૭/૨૦૪૦, ૨૮/૨૦૪૦, ૨૯/૨૦૪૦, ૩૦/૨૦૪૦, ૩૧/૨૦૪૦, ૧/૨૦૪૧, ૨/૨૦૪૧, ૩/૨૦૪૧, ૪/૨૦૪૧, ૫/૨૦૪૧, ૬/૨૦૪૧, ૭/૨૦૪૧, ૮/૨૦૪૧, ૯/૨૦૪૧, ૧૦/૨૦૪૧, ૧૧/૨૦૪૧, ૧૨/૨૦૪૧, ૧૩/૨૦૪૧, ૧૪/૨૦૪૧, ૧૫/૨૦૪૧, ૧૬/૨૦૪૧, ૧૭/૨૦૪૧, ૧૮/૨૦૪૧, ૧૯/૨૦૪૧, ૨૦/૨૦૪૧, ૨૧/૨૦૪૧, ૨૨/૨૦૪૧, ૨૩/૨૦૪૧, ૨૪/૨૦૪૧, ૨૫/૨૦૪૧, ૨૬/૨૦૪૧, ૨૭/૨૦૪૧, ૨૮/૨૦૪૧, ૨૯/૨૦૪૧, ૩૦/૨૦૪૧, ૩૧/૨૦૪૧, ૧/૨૦૪૨, ૨/૨૦૪૨, ૩/૨૦૪૨, ૪/૨૦૪૨, ૫/૨૦૪૨, ૬/૨૦૪૨, ૭/૨૦૪૨, ૮/૨૦૪૨, ૯/૨૦૪૨, ૧૦/૨૦૪૨, ૧૧/૨૦૪૨, ૧૨/૨૦૪૨, ૧૩/૨૦૪૨, ૧૪/૨૦૪૨, ૧૫/૨૦૪૨, ૧૬/૨૦૪૨, ૧૭/૨૦૪૨, ૧૮/૨૦૪૨, ૧૯/૨૦૪૨, ૨૦/૨૦૪૨, ૨૧/૨૦૪૨, ૨૨/૨૦૪૨, ૨૩/૨૦૪૨, ૨૪/૨૦૪૨, ૨૫/૨૦૪૨, ૨૬/૨૦૪૨, ૨૭/૨૦૪૨, ૨૮/૨૦૪૨, ૨૯/૨૦૪૨, ૩૦/૨૦૪૨, ૩૧/૨૦૪૨, ૧/૨૦૪૩, ૨/૨૦૪૩, ૩/૨૦૪૩, ૪/૨૦૪૩, ૫/૨